

6

હિસાબી પદ્ધતિની પ્રણાલિકાઓ—ધારણાઓ,  
ઘ્યાલો અને સિદ્ધાંતો

विभाग A

નીચે આપેલ બહુવિકલ્પ પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો :

1. ચાલુ પેઢીની ધારણાઓ [ ]  
(a) ભવિષ્યના સંદર્ભે છે.  
(b) વર્તમાનના સંદર્ભે છે.  
(c) ભૂતકાળના સંદર્ભે છે.  
(d) સંદર્ભવિહીન છે.

2. ચાલુ પેઢીની ધારણામાં કોનો સમાવેશ થતો નથી ? [ ]  
(a) ખાસ હેતુ માટે ન સ્થપાયેલ એકમ  
(b) ખાસ હેતુ માટે સ્થપાયેલ એકમ  
(c) આર્થિક રીતે સદ્ગ્રહ હોય.  
(d) ધંધાના વિસર્જનનો હેતુ ન હોય.

3. જે ઘસારાની પદ્ધતિ કે સ્ટોકના મૂલ્યાંકનની પદ્ધતિ બદલાય, તો તે કઈ ધારણા સાથે સંબંધ ધરાવે છે ? [ ]  
(a) ચાલુ પેઢીની ધારણા  
(b) સંપાદનનો સિદ્ધાંત  
(c) હિસાબી એકમ  
(d) એકસૂત્રતાનો જ્યાલ

4. સંપાદનના સિદ્ધાંતને [ ]  
(a) સમયગાળા સાથે સંબંધ છે.  
(b) સમયગાળા સાથે સંબંધ નથી.  
(c) ફક્ત રોકડ વ્યવહારો સાથે સંબંધ છે.  
(d) ફક્ત ઉધાર વ્યવહારો સાથે સંબંધ છે.

5. માર્ય મહિના માટે થયેલ ખર્ચ એપ્રિલમાં ચૂકવવામાં આવે અને તે ખર્ચ માર્ય મહિનાનો ગણાય, તો તેને ક્યો સિદ્ધાંત લાગુ પડે ? [ ]  
(a) ચાલુ પેઢી (b) સંપાદનનો સિદ્ધાંત (c) હિસાબી એકમ (d) એકસૂત્રતાનો સિદ્ધાંત

6. હિસાબી સમયનો જ્યાલ ક્યા જ્યાલ/સિદ્ધાંત સાથે નજીકનો સંબંધ ધરાવે છે. [ ]  
(a) ચાલુ પેઢીનો સિદ્ધાંત (b) નાણાકીય માપનો જ્યાલ  
(c) અલગ અસ્તિત્વનો જ્યાલ (d) પૂર્ણ રજૂઆતનો જ્યાલ

7. ક્યા જ્યાલ હેઠળ સંભવિત નુકસાન ધ્યાનમાં લેવાય છે પણ સંભવિત નફો નહિ ? [ ]  
(a) ચાલુ પેઢીનો સિદ્ધાંત (b) દૂરદર્શિતાનો જ્યાલ  
(c) નાણાકીય માપનો જ્યાલ (d) અલગ અસ્તિત્વનો જ્યાલ

8. રૂઢિયુસ્તતાના જ્યાલ સાથે નીચેનામાંથી કયું સંબંધ ધરાવતું નથી ? [ ]  
(a) દેવાદારો પર ઘાલખાધ અનામત  
(b) સ્ટોકનું બજારમૂલ્ય અથવા પડતર બેમાંથી જે ઓછું હોય તે  
(c) દેવાદારો પર વટાવ અનામત  
(d) મિલકતની બજારકિંમત ચોપડે દર્શાવવી.

9. વ્યવહારની બેવડી અસરનો જ્યાલ કઈ હિસાબીપદ્ધતિ પર આધારિત છે ?

[ ]

(a) દેશીનામાપદ્ધતિ

(b) એકનોંધી નામાપદ્ધતિ

(c) દ્વિનોંધી નામાપદ્ધતિ

(d) હાઇબ્રિડપદ્ધતિ

### વિભાગ B

નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો :

1. હિસાબી સિદ્ધાંતો શા માટે તૈયાર કરવામાં આવ્યા છે?

---

---

2. હિસાબી સિદ્ધાંતો કઈ રીતે ઓળખવામાં આવે છે?

---

---

3. હિસાબી સિદ્ધાંતો હિસાબો માટે કયો આધાર પૂરો પાડે છે?

---

---

4. હિસાબો તૈયાર કરતી વખતે ક્યા પ્રકારની હિસાબીનીતિઓ, વિધિઓ અને પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ ?

---

---

5. ચાલુ પેઢીની ધારણા અંગે એક ઉદાહરણ આપો.

---

---

6. હિસાબી પદ્ધતિની ‘ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા’ દ્વારા કઈ મૂળભૂત ધારણા આપવામાં આવેલ છે ?

---

---

7. આવકખર્યનાં સંપાદન માટેની બે પદ્ધતિઓ કઈ છે ?

---

---

8. ક્યા જ્યાલ હેઠળ ધંધો અને ધંધાનો માલિક અલગ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે ?

---

---

9. નાણાકીય માપનો જ્યાલ લાગુ ન પડતો હોય તેવું ઉદાહરણ આપો.

---

---

10. બાહોશ ઉત્પાદક મેનેજર ધંધામાંથી રાજીનામું આપે તેને ક્યો જ્યાલ લાગુ પડે છે ?

---

---

11. નાણાકીય પત્રકોમાં તમામ હિસાબી માહિતી દર્શાવવા માટે ક્યો જ્યાલ અસ્તિત્વમાં છે ?

---

---

12. મહત્વતાનો જ્યાલ ક્યા જ્યાલ સાથે સંકળાયેલ છે ?

---

---

13. રંઘિયુસ્તતાના સિદ્ધાંતનાં અન્ય નામો શું છે ?

---

---

14. નમૂના તરીકે મળેલ મફત માલ ક્યા જ્યાલનો અપવાદ છે ?

---

---

